

647510**0101225C1030****Seat No: _____****B.A. Semester - 2 (CBCS) Examination****March/April- 2018****ECONOMICS : P3 PRINCIPLES OF ECONOMICS-2
(CORE)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-૧ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનાં આંતર સંબંધો આકૃતિ દ્વારા સ્પષ્ટ કરો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૧ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનાં ખ્યાલો ઉદાહરણ અને આકૃતિની મદદથી સમજાવો.
- પ્રશ્ન-૨ ઘટતા મળતરનો નિયમ સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૨ પેઢી વિકાસનાં લાભોની ચર્ચા કરો.
- પ્રશ્ન-૩ વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૩ “નફો નવપ્રવર્તનનું પરિણામ છે.” – ચર્ચા કરો.
- પ્રશ્ન-૪ ભાડાનો આધુનિક સિદ્ધાંત સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૪ “નફો જોખમ વહોરવાનું નહિ, પરંતુ અનિશ્ચિતતા વહોરવાનું વળતર છે.” – ચર્ચા કરો. (૧૪)
- પ્રશ્ન-૫ ટ્રેકનોંધ લખો: (કોઈપણ બે) (૧૪)
- (૧) વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ.
- (૨) આભાસી ભાડું.
- (૩) કાચા નફા અને શુદ્ધ નફા વચ્ચેનો તફાવત.
- (૪) ઘટતા મળતરનાં નિયમની ઉપયોગિતા.

English Version

- Que-1 Clarify the interrelationships between Average cost and marginal cost with the help by diagram. (14)
OR
- Que-1 Explain the concept of fixed cost and variable cost with the help of illustration and figure.
- Que-2 Explain the law of Diminishing Returns. (14)
OR
- Que-2 Discuss the advantages of expansions size of firm.
- Que-3 Explain the marginal productivity theory of distribution. (14)
OR
- Que-3 "Profit is a result of innovation" – Discuss.
- Que-4 Explain the modern theory of rent. (14)
OR
- Que-4 "Profit is not reward for bearing of risks but reward for bearing of uncertainty" – Discuss.
- Que-5 Write a short note on. (any two) (14)
- (1) The concept of alternative cost.
 - (2) Quasi-Rent.
 - (3) Difference between gross profit & net profit.
 - (4) Usefulness of the law of diminishing return.
